AXIS/CO/CS/362/2022-23

October 25, 2022

National Stock Exchange of India Limited Exchange Plaza, 5th Floor Plot No. C/1, "G" Block Bandra-Kurla Complex Bandra (E), Mumbai – 400 051

BSE Limited P. J. Towers, Dalal Street,

Fort, Mumbai – 400 001

NSE Symbol: AXISBANK BSE Scrip Code: 532215

Dear Sir(s),

SUB: Publication of Notice in Newspaper containing Un-audited Financial Results of the Axis Bank Limited ("Bank")

Pursuant to the captioned subject, please find enclosed herewith copies of the newspaper clippings published by the Bank.

This is for your information and records.

Thanking you,

Yours Sincerely, For Axis Bank Limited

Sandeep Poddar **Company Secretary**

Encl: As above



PM TO FLAG OFF ROZGAR MELA TOMORROW

75K to get appointment letters on Day 1 of job fair

Prime Minister
Narendra Modi would
launch 'Rozgar Mela',
a drive to recruit one million
people, on October 22 via
video-conference. and video-conference, and appointment letters will be given to 75,000 candidates during the ceremony, the Prime Minister's Office (PMO) said on Thursday. The PMO said this will be

a significant step forward towards fulfilling the contin-uous commitment of the prime minister to providing job opportunities for the youth and ensuring welfare of citizens. The development comes amid the opposition's constant criticism of the BJP led government on the issue

led government on the issue of unemployment.
Opposition parties have alleged a lack of adequate employment opportunities, a charge rejected by the ruling Bharatily Janata Party (BJP). The drive will also help the BJP counter the Opposition in the poll-bound states of Himachal Pradesh and Guiarat.

states of Himachal Pradesh and Gujarat.

In June this year, Modi had asked various government departments and ministries to undertake the recruitment of one million people on a "mission mode" in the next year and a half.

According to the Thursday's statement, the direction from Modi came following a review of the status of human resources in all government departments and ministries, the Prime Minister's Office (PMO) said. Minister's Office (PMO) said

from across the country, will join 38 ministries or depart-ments of the Government of India. The appointees will

Mission Life launched: PM calls for concept of 'reduce, reuse & recycle'

Prime Minister Narendra Modi and United Nations Secretary General Antonic Guterres on Thursday launched Mission LiFE, a global plan of action aime saving the planet from the


climate change. The launch of the mis aimed at encouraging people towards sustainable living, comes ahead of next month's mega UN climatemeet in Egypt. The action plan — a list of

ideas on lifestyle changes that ideas on lifestyle changes th. can be taken up as climate-friendly behaviour — along with the logo and tagline for Mission LiFE (Lifestyle for Environment), were jointly launched by Modi and Guterres at Kevadia in Gujarat. Modi asked people to Modi asked people to

adopt the concept of 'reduce, reuse and recycle' and circular economy and said India is

economy and said India is committed to tackling the menace of climate change. He said Mission LIFE will strengthen the concept of a pro-people planet. The mission signifies "lifestyle of the planet, for the planet and by

Mission LiFE aims at following a three-pronged strategy for changing people's collective approach towards sustainability. This includes nudging individuals to practice simple yet effective environment-



Prime Minister Narendra Modi with UN Secretary-General Antonio Guterres during the global launch of Mission LiFE

friendly actions in their daily lives (demand), enabling lives (demand), enabling industries and markets to respond swiftly to the changing demand (supply), and to influence government and industrial policy to support both sustainable mption and production

(policy).

Modi said the prevailing notion that climate change is leaves this all important issu only to the government or international organisations. "People are experiencing the effects of climate change

the last few decades unexpected calamities were witnessed. This makes i amply clear that climate change goes beyond just policy-making," he said. The PM said the mantra o Mission LiFE is 'Lifestyle For

tted), Group B (Non-Gazetted) and Group C. The posts on which appointments are being made include the central arm-ed force personnel, sub-inspec-

tors, constables, LDC, steno, PA, income tax inspectors and MTS among others, it read. These recruitments are being done by ministries and departments either by them-selves or through recruiting agencies such as UPSC, SSC and the Railway recruitment Board.

ACCENT REGION

CHHATTISGARH

Colleges to come up in remote areas under PPP

The Chhattisgarh government will run colleges in backward areas and places

colleges in backward areas and places difficult to access, under the public-private partnership (PPP) model.

The Cabinet has passed a proposal on this. Officials in the higher education department said the move was part of a number of innovations taken up by the Bhupesh Baghel government in education.

number of innovations (above).

Bupesh Baghel government in education.

"Opening colleges on the PPP model in Chhattisgarh is an innovation for the state because no such scheme has been implemented in the past. None of the existing private colleges is operating under the arrangement provisioned in the proposed scheme," an official said. Under the Madhya Pradesh Private Colleges and Institutions (Establishment and Regulation) Act, 12 private colleges in the state are being run under 100 per cent regular grants. After the formation

in the state are being run under 100 per cent regular grants. After the formation of Chhattisgarh, 50 per cent funding is being provided to four private colleges under the Chhattisgarh Non-Government Colleges and Institutions (Establishment and Regulation) Act, 2006, with the approval of the Cabinet. Besides, once in three years an ad hoc grant is given for building an extension, furniture, and equipment up to a maximum of ₹500,000. Under the proposed



plan, the state government will grant \$1.75 crore for establishing colleges in backward areas and those with difficult terrain, respectively, on the PPP model. This subsidy will be provided on the fixed capital investment to be given fixed capital investment to be given to colleges.

According to officials, the state gov

50 per cent. The land should not be us 50 per cent. The land should not be used for anything other than academic purposes. At the end of the term, the lease can be extended with the consent of both the parties. The government will pay 50 per cent of the interest on the maximum loan of \$500 crore taken for infrastructure construction.

The strawill of the scholarships to students of the consent of the structure of th

The state will give scholarships to stu-dents studying all the courses.

UTTAR PRADESH

UP eves bigger share in millet export pie

Uttar Pradesh (UP), the second-largest millet-producing state, is looking to expand its share of exports. According to a government official, the state is takto a government official, the state is tak-ing proactive steps to increase the acreage of millets by reviving traditional and indigenous crops under the rain-fed farming system. "Millets provide a spectrum of low-risk crops, which are resilient to climate

risk crops, which are resilient to climate change. The state government has planned to promote the cultivation of planned to promote the cultivation of such nutritious cereals in rainfed areas," he said. The Yogi Adityanath government is aiming to increase the baira acreage from 980,000 hectares (ha) to a million and hike its production from 24.55 quintal/ha to 25.53 quintal/ha. The state also plans to expand jowar acreage from 215,000 ha to 224,000 ha. Some of the major millet crops grown in UP are jowar, bajra, kodo and sanua.

sanwa.

UP produces 5 million tonnes of millet

— 20 per cent of India's annual output.
India is the world's fifth largest millet
exporter with exports rising at a compound annual growth rate (CAGR) of 3
percent. Shipments from India were valpercent. Shipments from Indi ued at \$27 million in 2020-21.

RAJASTHAN

Milk scheme benefits 800,000 producers

ANIL SHARMA Jaipur, 20 Octobe

More than 800,000 milk producers have benefited from a special scheme of the state government, a senior state government official said.

"Milk producers are getting support from the Mukhyamantri Dugdh Urpadak Sambal Vojana (Chief Minister Milk Producers International Chief Minister Milk Sambal Vojana (Chief Minister Milk Producers National Scheme).

Producers Support Scheme), leading to an improvement in their financial

cattle. The state government started this scheme in 2019. Under it, milk producers were being given a subsidy of \$2\$ per litre. In the 2022-23 Budget, the subsidy was increased to \$5\$ per litre and milk producers started getting if from April 1, 2022. More than \$600 crore was paid between Express 2019 and the \$2\$ per litre is the part 2019 and the \$2\$ per litre is the part 2019 and the \$2\$ per litre is the part 2019 and the \$2\$ per litre is the part 2019 and the \$2\$ per litre is the part 2019 and the \$2\$ per litre is the part 2019 and the \$2\$ per litre is the part 2019 and the \$2\$ per litre is the part 2019 and the \$2\$ per litre is the part 2019 and the \$2\$ per litre is the part 2019 and the \$2\$ per litre is the part 2019 and the part 2019

paid between February 2019 and March 2022 to milk producers associated with cooperative dairies. It is proposed to give a idy of ₹550 crore to milk lucers this financial year. The government, to give employi

opportunities in milk production, nas announced openings,000 dairy booths this fiscal year. Of those 1,000 will be given to women and women self-help groups (SHGs). The ment Rajasthan (Cooperative Dairy reced Federation (RCDF), according to the chief minister's announcement, has allotted 434 dairy booths till August 31, 2022, hs this incial women SHGs. In 2021-22, against a proposal to open 5,000 dairy booths, the RCDF hit the figure 5,269 by March 31, 2022.

opportunities in milk production, has

CIN: L65110GJ1993PLC020769, Phone: 079-26409322, Fax: 079-26409321, Email: shareholders@axisbank.com

AXIS BANK LTD.

UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30TH SEPTEMBER, 2022

AND HALF TEAR ENDED 30 " SEPTEMBER, 2022								
	Axis	Bank (Standa	lone)	Axis E	Bank (Consoli	lidated)		
PARTICULARS	FOR THE QUARTER ENDED 30.09.2022	FOR THE HALF YEAR ENDED 30.09.2022	FOR THE QUARTER ENDED 30.09.2021	FOR THE QUARTER ENDED 30.09.2022	FOR THE HALF YEAR ENDED 30.09.2022	FOR THE QUARTER ENDED 30.09.2021		
Total income from operations	24,180,08	45,907,69	20,134,39	25,258,80	47,945,26	20,966,6		
Net Profit / (Loss) for the period (before tax, exceptional and/or extraordinary items)	7,166,43	12,694,07	4,193,08	7,572,74	13,455,56	4,541,5		
Net Profit / (Loss) for the period before tax (after exceptional and/or extraordinary items)	7,166,43	12,694,07	4,193,08	7,572,74	13,455,56	4,541,5		
Net Profit / (Loss) for the period after tax (after exceptional and/or extraordinary items)	5,329,77	9,455,03	3,133,32	5,612,33	9,992,92	3,387,7		
Total Comprehensive Income for the period [Comprising Profit/ (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	Refer note 1	Refer note 1	Refer note 1	Refer note 1	Refer note 1	Refer note		
Paid-up equity share capital (Face value ₹2/- per share)	614,46	614,46	613,33	614,46	614,46	613,3		
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	1,14,411,51 (As on 31st March, 2022)	1,14,411,51 (As on 31st March, 2022)	1,00,990,26 (As on 31st March, 2021)	1,17,495,94 (As on 31st March, 2022)	1,17,495,94 (As on 31st March, 2022)	1,02,980,9 (As on 31 March, 202		
Earnings per Share (Face value ₹2/- per share) (for continuing and discontinued operations) (₹) (not annualised)								
- Basic - Diluted	17.35 17.23	30.79 30.72	10.22 10.19	18.27 18.14	32.54 32.47	11.0 11.0		
Securities Premium Account	51,635,32	51,635,32	51,367,88					
Net Worth	1,16,152,45	1,16,152,45	98,916,07					
Outstanding Debts	1,81,399,99	1,81,399,99	1,58,709,45					
Outstanding Redeemable Preference Shares	Nil	Nil	Nil					
Debt Equity Ratio	1.46	1.46	1.48					
Capital Redemption Reserve	Nil	Nil	Nil					
Debenture Redemption Reserve	Nil	Nil	Nil					

- The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filled with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the website of the Bank (www.axisbank.com) and on the Stock Exchange websites (www.nseindia.com and www.bseindia.com).

 Previous period figures have been regrouped and reclassified, where necessary, to make them comparable with current neriod figures.

Place: Mumbai Date: 20th October, 2022

AMITABH CHAUDHRY

ITC Limited

Extract of Unaudited Standa ults for the Quarter and Six Months ended 30th September, 2022

Particulars Net Profit / (Loss) for the period before tax and Exceptional items) 5938.54 11478.09 4880.12 6238.81 12189.30 5054.89 let Profit / (Loss) for the period before ta 11478.0 6238.8 Net Profit / (Loss) for the period after tax 4466.06 8635.4 3697.18 4681.85 9153.88 3766.38 Comprising Profit / (Loss) for the period after tax) and Other Comprehensive Inco after tax)] 4996.20 8829.86 3848.54 5307.16 9223.63 3929.63 arnings Per Share (of ₹1/- each) (not annualised) 1. Basic (₹) 3.6 6.9 3.73 7.29 3.02 2. Diluted (₹) 6.98 3.72 7.28 3.02 3.60 3.00

a) The above is an extract of the detailed format of the Statements of Unaudited Standalone and Consolidated Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation 2,215.

The Unaudited Financial Results and this extract were reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at their respective meetings held on 20th October, 2022. The full format of the Statements of Unaudited Standalone and Consolidated Financial Results are available on the Company's website (www.itcportal.com) and on the websites of the National Stock Exchange of India Limited (www.nseindia.com), BSE Limited (www.bseindia.com) and The Calcutta Stock Exchange Limited (www.cse-india.com).

ew, as required under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, has been completed and the related Reports have been forwarded to the Stock Exchanges. These Reports do not have any impact on the above 'Results and Notes' for the Quarter and Six Months ended 30th September, 2022 which needs

Virginia House, 37 J.L. Nehru Road Kolkata 700 071, India Dated: 20th October, 2022

Director & Chief Financial Officer

Chairman & Managing Directo

For and on behalf of the Board

Website: www.itcportal.com | E-mail: enduringvalue@itc.in
Phone: +91-33-2288 9371 | Fax: +91-33-2288 0655 | CIN: L16005WB1910PLC001985

AASHIRVAAD Suffees (DISC) SUNRISE WAS THE FANTASY MACH! FORMIKE



FMCG | Hotels | Paperboards & Packaging | Agri Business | Information Technology





ITC beats Street with 21% jump in Q2 profit

Co expects consumption to rise led by cooling inflation, normal rains

feedback@livemint.com **NEW DELHI**

iversified conglomerate ITC Ltd on Thursday beat street estimates to post a 20.7% rise in September quarter net profit, as it sold more cigarettes and its hotels business benefitted from greater domestic travel.

Net profit at the country's largest cigarette maker rose to ₹4,466.06 crore in the three months ended 30 September from the ₹3,697.18 crore a year ago. A Bloomberg poll of analysts had forecast a net profit of ₹4,095.60

The maker of Aashirvaad wheat flour and Savlon soaps recorded standalone revenue of ₹17,159.56 crore in the quarter, up 26.6% from ₹13,553.52 crore in the year-ago period. The company reported revenue growth across verticals.

However, revenue was down from the June quarter.

The company reported earnings before interest, tax, depreciation and amortization (Ebitda) of ₹5,860 crore, up 27% from a year earlier.

THE pick-up in

offset inflationary

The pick-up in festive season linked demand helped offset inflationary headwinds that weighed on consumption expenditure, ITC said in a filing to

stock exchanges. ITC expects a pick-up in consumption expenditure in the second half of the year led by moderation in inflation, coupled with a normal monsoon in most parts of the country, and proactive intervention by the government and the central bank.

The cigarette business recovered further in the September quarter,



The FMCG (non-cigarettes) businesses grew 21% over the year; staples and convenience foods recorded robust growth.

with revenue growing 23.2% to ₹6,953.80 crore from ₹5641.72 crore a year earlier. Volumes grew, too, in what analysts have termed a "positive surprise"

"ITC cigarette volumes beat versus ours and street estimates with volume growth of 22% year-on-year," said

SEASON OF CHEER

THE cigarette festive season linked business recovered in September quarter, with revenue growing 23.2%

REVENUES at the company's hotels 81.8% during the

Abneesh Roy, executive director, Nuvama Institutional Equities.

The FMCG (non-cigarettes) businesses grew 21% over the year; staples and convenience foods recorded robust growth mainly driven by biscuits, atta and noodles, the company said. In the personal care portfolio, fragrances registered strong growth while the Fiama and Vivel range of

personal wash products performed

The hygiene segment was subdued while remaining significantly ahead of pre-pandemic levels, it said.

Revenues at the company's hotels business, a sector that has benefitted from the lifting of restrictions on mobility, jumped 81.8%

during the quarter. "Average room rate and occupancy ahead of pre-pandemic levels driven by retail (packages), leisure, weddings and MICE segments.

Domestic business travel continues to witness progressive normalisation; inbound foreign travel has also picked up," according to the company. Meanwhile, the company's paperboards, paper and packaging segment revenue was up 25% during the quarter. Revenue for the agriculture business was up 44.0% year-on-year driven by wheat, rice and leaf tobacco exports.

'LIC may recover its investment in IDBI Bank'

share

feedback@livemint.com

tate-owned insurance behemoth LIC is expected to recover its ₹21,624 crore investment it had made in IDBI Bank as share prices are likely to rebound to 2019 levels by the time the lender is privatised, an official

The official said that since the commencement of the IDBI Bank privatization process in May last year, the share price has jumped from ₹35 a share to ₹45 a piece cur-

"We are expecting IDBI Bank scrip to move up further. The price is expected to move up closer to the price at which LIC had picked up stake in 2019," the official said.

The government and Life Insurance Corp (LIC) together hold 94.72% in IDBI Bank. Of this, LIC's holding is 49.24%, while the government holds the rest 45.48% stake. Public share-

LIC had bought a 51% stake in IDBI Bank in 2019 for ₹21,624 crore at an average price of ₹61 per share. Following a QIP issue in December 2020, the stake of LIC came

holders hold 5.28%.

down to 49%. Besides, the government and LIC together infused ₹9,300 crore in IDBI Bank to bring it out of RBI's Prompt Corrective Action (PCA)

"IDBI Bank privatisation will be a win-win for both the government and LIC," the official added. Shares of IDBI Bank closed at ₹44.95, up 2.16% over previous close on the BSE.

LIC had bought At the current market price, sale of a 51% stake in 61% stake would fetch IDBI Bank in 2019 about ₹29,000 crore for ₹21,624 crore to the exchequer. at an average The announceprice of ₹61 per

> made in the Union Budget of 2021-22, following which the Cabinet Committee on Economic Affairs gave in-principle approval for strategic disinvestment and transfer of

ment of IDBI Bank

privatisation was first

management control in May 2021. On 7 October, the government

invited EoIs from investors for buying 60.72% stake, along with management control, in IDBI Bank and set 16 December deadline for submitting preliminary

The Department of Investment and Public Asset Management (DIPAM), while inviting Expressions of Interest (EoI) from potential investors, said that the potential investor should have a minimum net worth of ₹22,500 crore, must report net profit in 3 out of the past 5 years to be eligible for bidding for IDBI Bank and a maximum of 4 members would be

allowed in a consortium. The successful bidder would be required to mandatorily lock-in at least 40% of the equity capital for 5 years from the date of acquisition.



STATEMENT OF FINANCIAL	RESULTS FOR TH	F QUARTER F	NDED SEPTEMBE	R 30 20	022

(Rs. in Crores except per share data)

		Standalone			Consolidated	
	3 months ended 30.09.2022	3 months ended 30.09.2021	Year ended 31.03.2022	3 months ended 30.09.2022	3 months ended 30.09.2021	Year ended 31.03.2022
Particulars	(Unaudited)	(Unaudited)	(Audited)	(Unaudited)	(Unaudited)	(Audited)
Total income from operations (net) Net Profit/(loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	17.85 7.59	14.85 5.13	202.06 147.08	9,322.59 73.83	9,327.37 49.89	31,187.58 388.65
Net Profit/(loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	7.59	5.13	147.08	73.83	49.89	388.65
Net Profit/(loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	4.79	3.53	102.62	61.61	47.65	318.40
Total comprehensive income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	4.80	3.99	102.98	62.03	45.01	306.49
Paid-up equity share capital (Face Value Rs. 2 Per Share) Reserves excluding revaluation reserve as per balance sheet of	69.02	69.02	69.02 6,680.57	69.02	69.02	69.02 3,865.59
previous accounting year	-	-	0,000.57	-	-	3,003.39
8. Earnings per share (of Rs. 2 each) (not annualised)						

The above is an extract of the detailed format of financial results for the quarter and six months ended September 30, 2022 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation 2015. The full format of the quarter and six months ended Financial Results are available on the Stock Exchange website, www.nseindia.com Company's website www.maxfinancialservices.com

0.14

Date: October 19, 2022 Place: Gurugram

a) Basic (Rs.)

b) Diluted (Rs.)



By Order of the Board Mohit Talwar Managing Director DIN: 02394694



Regd. Office: 'Trishul', 3rd floor, Opp. Samartheshwar Temple, Near Law Garden, Ellisbridge, Ahmedabad - 380 006. Corporate Office: 'Axis House' C-2, Wadia International Centre, Pandurang Budhkar Marg, Worli, Mumbai - 400 025. CIN: L65110GJ1993PLC020769, Phone: 079-26409322, Fax: 079-26409321, Email: shareholders@axisbank.com

UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30TH SEPTEMBER, 2022

(₹ in lacs)

	Axis	Bank (Standa	lone)	Axis Bank (Consolidated)			
PARTICULARS	FOR THE QUARTER ENDED 30.09.2022	FOR THE HALF YEAR ENDED 30.09.2022	FOR THE QUARTER ENDED 30.09.2021	FOR THE QUARTER ENDED 30.09.2022	FOR THE HALF YEAR ENDED 30.09.2022	FOR THE QUARTER ENDED 30.09.2021	
Total income from operations	24,180,08	45,907,69	20,134,39	25,258,80	47,945,26	20,966,61	
Net Profit / (Loss) for the period (before tax, exceptional and/or extraordinary items)	7,166,43	12,694,07	4,193,08	7,572,74	13,455,56	4,541,52	
Net Profit / (Loss) for the period before tax (after exceptional and/or extraordinary items)	7,166,43	12,694,07	4,193,08	7,572,74	13,455,56	4,541,52	
Net Profit / (Loss) for the period after tax (after exceptional and/or extraordinary items)	5,329,77	9,455,03	3,133,32	5,612,33	9,992,92	3,387,70	
Total Comprehensive Income for the period [Comprising Profit (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	Refer note 1	Refer note 1	Refer note 1	Refer note 1	Refer note 1	Refer note 1	
Paid-up equity share capital (Face value ₹2/- per share)	614,46	614,46	613,33	614,46	614,46	613,33	
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	1,14,411,51 (As on 31st March, 2022)	1,14,411,51 (As on 31st March, 2022)	1,00,990,26 (As on 31st March, 2021)	1,17,495,94 (As on 31st March, 2022)	1,17,495,94 (As on 31st March, 2022)	1,02,980,95 (As on 31st March, 2021)	
Earnings per Share (Face value ₹2/- per share) (for continuing and discontinued operations) (₹) (not annualised)							
- Basic - Diluted	17.35 17.23	30.79 30.72	10.22 10.19	18.27 18.14	32.54 32.47	11.05 11.02	
Securities Premium Account	51,635,32	51,635,32	51,367,88				
Net Worth	1,16,152,45	1,16,152,45	98,916,07				
Outstanding Debts	1,81,399,99	1,81,399,99	1,58,709,45				
Outstanding Redeemable Preference Shares	Nil	Nil	Nil				
Debt Equity Ratio	1.46	1.46	1.48				
Capital Redemption Reserve	Nil	Nil	Nil				
Debenture Redemption Reserve	Nil	Nil	Nil				

Note:

- 1. Information relating to Total Comprehensive Income and Other Comprehensive Income is not furnished as Ind AS is not yet made
- 2. The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the website of the Bank (www.axisbank.com) and on the Stock Exchange websites (www.nseindia.com and
- 3. Previous period figures have been regrouped and reclassified, where necessary, to make them comparable with current period figures

For and on behalf of the Board

AMITABH CHAUDHRY



Additi

S. No.

MAX LIFE INSURANCE COMPANY LIMITED

0.10

2.97

1.49

YOU ARE THE DIFFERENCE™

IRDAI REGISTRATION NO.: 104 | DATE OF REGISTRATION WITH IRDAI: NOVEMBER 15, 2000 Registered Office: Max Life Insurance Company Limited, 419, Bhai Mohan Singh Nagar, Railmajra, Tehsil Balachaur, District Nawanshahr, Punjab -144 533

Corporate Office: Max Life Insurance Company Limited, 11th Floor, DLF Square, Jacaranda Marg, DLF City Phase II, Gurgaon - 122002

Standalone Financial Results Six Months ended / as on Three months ended / as on Year Ended / as on June March **Particulars** 30, 2022 30, 2022 30, 2021 30, 2022 30, 2021 31, 2022 (Audited) (Audited) (Audited) (Audited) (Audited) (Audited) 580,115 410,307 533,121 990,422 881,527 2,241,417 Premium Income (Gross) Net Profit / (Loss) for the period (before Tax, Exceptional 7,071 14,365 41,695 5,306 9,058 14,764 and / or Extraordinary items) Net Profit / (Loss) for the period before Tax 5,306 9,058 7,071 14,365 14,764 41,695 (after Exceptional and / or Extraordinary items) Net Profit / (Loss) for the period after Tax 4.554 7.788 6.630 12.343 13.711 38.665 (after Exceptional and / or Extraordinary items) Total Comprehensive Income for the period {Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax) } 10 191,881 191,881 191,881 Equity Share Capital (paid up) 191.881 191.881 191.881 Reserves (excluding Revaluation Reserve and 135.084 131.645 103.124 135.084 103.124 127.595 Fair Value Change Account) Earning Per Share (Face value of ₹ 10 each) 1. Basic (not annualized for three / six months) (in ₹) 0.24 0.35 0.64 0.71 2.02 0.41 2. Diluted (not annualized for three / six month) (in ₹) 2.02 0.24 0.41 0.35 0.64 0.71

onal details based on Standalone Results of the Company as per Regulation 52(4) of SEBI LODR are as under:									
	Three i	nonths ended /	as on	Six Months e	Year Ended / as on				
Particulars	September 30, 2022	June 30, 2022	September 30, 2021	September 30, 2022	September 30, 2021	March 31, 2022			
	(Audited)	(Audited)	(Audited)	(Audited)	(Audited)	(Audited)			
Total Borrowings	49,600	49,600	49,600	49,600	49,600	49,600			
Debt Equity Ratio (no. of times) ²	0.16	0.16	0.18	0.16	0.18	0.16			
Debt Service Coverage Ratio (no. of times) ³	6.60	10.77	12.57	8.66	25.14	17.98			
Interest Service Coverage Ratio (no. of times) ⁴	6.60	10.77	12.57	8.66	25.14	17.98			
Control Deleganting December / Deleganting Deleganting December	1.00	0 /1	0 /1	1.00	0 /1	0.71			

		(Audited)	(Audited)	(Audited)	(Audited)	(Audited)	(Audited)
1	Total Borrowings	49,600	49,600	49,600	49,600	49,600	49,600
2	Debt Equity Ratio (no. of times) ²	0.16	0.16	0.18	0.16	0.18	0.16
3	Debt Service Coverage Ratio (no. of times) ³	6.60	10.77	12.57	8.66	25.14	17.98
4	Interest Service Coverage Ratio (no. of times) ⁴	6.60	10.77	12.57	8.66	25.14	17.98
5	Capital Redemption Reserve / Debenture Redemption Reserve	1.30	2.61	2.61	1.30	2.61	2.61
6	Net Worth ⁵	318,849	312,848	283,202	318,849	283,202	306,381
7	Current Ratio ⁶	1.00	0.84	0.89	1.00	0.89	0.97
8	Current Liability Ratio ⁷	0.03	0.03	0.04	0.03	0.04	0.03
9	Total Debt to Total Assets ⁸	0.00	0.00	0.00	0.00	0.00	0.00

Notes: 1) Premium Income is gross of reinsurance and net of Goods & Service tax

Description incomers gross or emistratice and net of cooks a service as.

2) Debt Equity Ratio is calculated as Total Borrowings divided by Net worth. Net worth is shareholders funds including Credit / (Debit) Fair Value
Change Account and excluding Realized Hedge Reserve - Policyholder.

3) DSCR is calculated as Profit before interest and tax divided by interest expense together with principal repayments of long-term debt during the period.

4) ISCR is calculated as Profit before interest and tax divided by interest expense. 5) Net worth is shareholders funds including Credit / (Debit) Fair Value Change Account and excluding Realized Hedge Reserve - Policyholder.

Ourrent Liability Ratio is computed as current liability divided by total liability. Total liability includes borrowings, policyholder liabilities, Fund for Future Appropriation, current liability, provision and realized hedge fluctuation reserve.

§ Total Debts to Total Assets is total borrowings divided by total assets as per balance sheet.

Credit Rating: "CRISIL AA+stable" and "ICRA AA+stable".

10) The new Indian Accounting standard (Ind AS) are currently not applicable to insurance companies in India.

The above is an extract of the detailed format of quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 52 of the SEBI (Listed Obligation and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of Quarterly Financial Results are available on the Stock Exchange website (www.nseindia.com) and the Company's website (www.maxilfeinsurance.com)

For and on behalf of



Place: Mumbai

નામદાર જજ શ્રી પી. અગ્રવાલ સાહેબની કોર્ટ નં. ૨૩માં જાહેર સમન્સ

અમદાવાદની સીટી સીવીલ કોર્ટ ખાતે કોર્ટની કોમર્શિયલ કોર્ટમાં કોમર્શિયલ સીવીલ સ્થુટ નં. ૧૧७૬/૨૦૨૧

યાદીના વકીલ શ્રી - વાચ. સી. શેઠ

Exh. 13 : ભારતીય સ્ટેટ બેંક, તેમની કેન્દ્રીય કચેરી મંબઈ ખાતે. સ્થાનિક વડી કચેરી લાલ દરવાજા, અમદાવાદ ખાતે, ઝોનલ કરોરી - સી.એન.વિદ્યાલય પાસે આંબાવાડી, અમદાવાદ ખાતે, અન્ય ઠેકાણે તેમની શાખા/કચેરીમાંથી એક સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝ સિટી ક્રેડિટ સેન્ટર (એસએમઇસીસી) તરીકે ઓળખાતી શાખા , સરનામુ: ૨૦૧ , ૨૦૫ , શુકન-॥, સ્વસ્તિક ચાર રસ્તા , કોમર્સ કોલેજ રોડ, નવરંગપુરા, અમુદાવાદ-૩૮૦૦૦૯.

વિરુધ્ધ

मे. परेश आर्ट तेमना प्रोपरायटर કाળુભાઈ नाજીભાઈ सोन्हागर मारङ्ते, સરનામુ:- (૧) શેડ નં. ૫, કૈલાશ એસ્ટેટ, મ્યુનિસિપલ ગાર્ડનની સામે, સ્કુલ પાસે, વિરાટનગર રોડ, ઓઢવ, અમદાવાદ-૩૮૨૩૨૫.

૧૪, ગોકુલ પાર્ક સોસાયટી, અંબિકા સોસાયટી પાસે, ઓઢવ, અમદાવાદ 3८२४१५.

स्थुट २५भ : ३।. ५,५३,०९३-७९

આથી તમો પ્રતિવાદીને અહીં જાણ કરવામાં આવે છે કે તમારી વિરૂદ્ધ આ કોર્ટ દ્વારા nરી કરાચેલા સમન્સ સતત અસ્વીકૃત રહ્યા છે અને તમારા હાલના સરનામા જાણમાં હોવાથી આ સમન્સ પ્રકાશિત કરવામાં આવે છે.

आथी ઉपरोक्त नामना वाहीं सीवील प्रोसीकर १६०८ ना डोडना ओर्डर न XXXVII હેઠળ તમારી વિરૂદ્ધ કેસ દાખલ કરવાની તારીખથી ચૂકવણી સુધીના વ્યાજ અને પડતર સહિત **રૂા. ૬,૬૩,૦૧૩-૯૧** માટે કેસ દાખલ કર્યો છે. ત^{ેમ}ને આર્થી પ્રકાશનથી દસ દિવસની અંદર તમારા માટે કારણ દર્શાવવા અને હાજર રહેવા માટે બોલાવવામાં આવે છે જેમાં નિષ્ફળ જવા પર વાદી એવા દસ દિવસ પૂરા થયા પછી કોઈપણ સમયે **રા. ૬,૬૩,૦૧૩-૯૧** થી વધુ નહીંની કોઇપણ સ્કમ અને કોર્ટ આપે તે મુજબ પડતરો અને વ્યાજની જે કોર્ટ કોઇ આપે તે સ્કમનો ચુકાદો મેળવવાને હકદાર રહેશે.

જો તમે તમારા માટે કારણ દર્શાવવા અને હાજરી આપો, તો વાદી તે પછી તમને સુનાવણી મતે ચુકાદા માટે સમન્સ આપશે. તમે તે પછી કોર્ટને દાવાની મુક્તિ માટે બચાવ કરવા માટે કહી શકશો

જો તમે કોર્ટને એફ્ડિવિટ દ્વારા અથવા અન્ય રીતે સંતુષ્ટ કરો છો કે યોગ્યતાના આધારે

દાવા માટે બચાવ છે અથવા જો વાજબી હોય તો બચાવ કરવાની રજા મેળવી શકાશે. આજે તા. ૧૪મી ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ મારી સહી અને કોર્ટના સિક્કા હેઠળ

તપાસી જોનાર તૈયાર કરનાર

(કે. આર. પરીખ) આસીસ્ટન્ટ બેંચ ક્લાર્ક



(એ. પી. જોષી), રજીસ્ટ્રાર, સીટી સીવીલ કોર્ટ, MG. ZHHEIQIE

નામદાર જજ શ્રી પી. અગ્રવાલ સાહેબની કોર્ટ નં. ૨૩માં

જાહેર સમન્સ અમદાવાદની સીટી સીવીલ કોર્ટ ખાતે કોર્ટની કોમર્શિયલ કોર્ટમાં

કોમર્શિચલ સીવીલ સ્થુટ નં. ૧૩૫૪/૨૦૨૧ Exh. 14 વાદીના વકીલ શ્રી - વાય. સી. શેઠ

: ભારતીય સ્ટેટ બેંક, તેમની ફેન્દ્રીય કરોરી મંબઈ ખાતે. સ્થાનિક વડી કરોર્ટ લાલ દરવાજા, અમદાવાદ ખાતે, ઝોનલ કરોરી - સી.એન.વિદ્યાલય પાસે આંબાવાડી, અમદાવાદ ખાતે, અન્ય ઠેકાણે તેમની શાખા/કરોરીમાંથી એક સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝ સિટી ક્રેડિટ સેન્ટર (એસએમઇસીસી) તરીકે ઓળખાતી શાખા , સરનામુ : ૨૦૧ , ૨૦૫ , શુકન-॥ , સ્વસ્તિક ચાર રસ્તા , કોમર્સ કોલેજ રોડ, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯. વિરુધ્ધ

મે. આશાપુરા કિચન વેર તેમના પ્રોપરાયટર તેજાજી નેતાજી પટેલ મારફતે સરનામુ:- ૫, દ્વારકેશ કોમ્પલેક્ષ, વિમલ સ્ટેશનરી પાસે, સરકારી ટ્યૂબવેલન સામે, બોપલ, અમદાવાદ-૩૮૦૦૫૮.

રહેઠાણનું સરનામુ : એ/૯, આમંત્રણ બંગલોઝ, પ્રથમ વાટિકા સામે, આરોહી ક્લબ રોડ, બોપલ, અમદાવાદ-૩૮૦૦૫૮.

સ્થુટ રકમ : રૂા. ૫,૮૨,७૬૨-૨૪

આથી તમો પ્રતિવાદીને અહીં જાણ કરવામાં આવે છે કે તમારી વિરૂદ્ધ આ કોર્ટ દ્વારા nરી કરાચેલા સમન્સ સતત અસ્વીકૃત રહ્યા છે અને તમારા હાલના સરનામા જાણમાં હોવાથી આ સમન્સ પ્રકાશિત કરવામાં આવે છે.

આથી ઉપરોક્ત નામના વાદીએ સીવીલ પ્રોસીજર ૧૯૦૮ ના કોડના ઓર્ડર ન XXXVII હેઠળ તમારી વિરૂદ્ધ કેસ દાખલ કરવાની તારીખથી ચૂકવણી સુધીના વ્યાજ અન પડતર સહિત **રૂા. ૫,૮૨,७૬૨-૨૪** માટે કેસ દાખલ કર્યો છે. ત[ે]મને આર્થી પ્રકાશનથી દસ્ દિવસની અંદર તમારા માટે કારણ દર્શાવવા અને હાજર રહેવા માટે બોલાવવામાં આવે છે જેમાં નિષ્ફળ જવા પર વાદી એવા દસ દિવસ પૂરા થયા પછી કોઈપણ સમયે રા. ૫,૮૨,७૬૨-२४ थी वधु नहींनी डोईपए रडम अने डोर्ट आपे ते मुक्ल पडतरो अने व्याक्नी के डोर्ट કોઈ આપે તે રકમનો ચુકાદો મેળવવાને હકદાર રહેશે.

જો તમે તમારા માટે કારણ દર્શાવવા અને હાજરી આપો , તો વાદી તે પછી તમને સુનાવર્ણ ખતે ચુકાદા માટે સમન્સ આપશે. તમે તે પછી કોર્ટને દાવાની મુક્તિ માટે બચાવ કરવા માટે

બે તમે કોર્ટને એફ્ડિવિટ દ્વારા અથવા અન્ય રીતે સંતુષ્ટ કરો છો કે યોગ્યતાના આધારે દાવા માટે બચાવ છે અથવા જો વાજબી હોય તો બચાવ કરવાની રજા મેળવી શકાશે .

આજે તા. ૧૦મી ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ મારી સહી અને કોર્ટના સિક્કા હેઠળ પવામાં આવ્યું.

તૈયાર કરનાર તપાસી જોનાર (સી. એમ. મહીડા) (કે. આર. પરીખ) આસીસ્ટન્ટ બેંચ ક્લાર્ક

(એ. પી. જોષી) રજીસ્ટ્રાર, સીટી સીવીલ કોર્ટ, ભદ્ર, અમદાવાદ

નામદાર જજ શ્રી પી. અગ્રવાલ સા<u>હે</u>બની કોર્ટ નં. ૨<u>૩માં</u>

જાહેર સમન્સ અમદાવાદની સીટી સીવીલ કોર્ટ ખાતે કોર્ટની કોમર્શિયલ કોર્ટમાં કોમર્શિયલ સીવીલ સ્થુટ નં. ૩૬૮૨/૨૦૨૧

વાદીના વકીલ શ્રી - વાય. સી. શેઠ

Exh. 16 : ભારતીય સ્ટેટ બેંક , તેમની કેન્દ્રીય કચેરી મુંબઈ ખાતે , સ્થાનિક વડી કચેરી લાલ દરવાજા, અમદાવાદ ખાતે, ઝોનલ કરોરી - સી.એન.વિદ્યાલય પાસે, આંબાવાડી, અમદાવાદ ખાતે, અન્ય ઠેકાણે તેમની શાખા/કચેરીમાંથી એક સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝ સિટી ક્રેડિટ સેન્ટર (એસએમઇસીસી) તરીકે ઓળખાતી શાખા, સરનામુઃ ૨૦૧, ૨૦૫, શુકન-॥, સ્વસ્તિક ચાર રસ્તા, કોમર્સ કોલેજ રોડ, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯.

વિરુધ્ધ મે. શ્રી ક્રિપ્ના ક્રિએશન તેમના પ્રોપરાયટર જીતેન્દ્ર અશોકકુમાર નાઝકાની પ્રતિવાદી : મારફતે, સરનામુ : ૩૧૭, ૩૧૧ે માળ, રાજ કોમ્પલેક્ષ, બીબીસી માર્કેટ પાંચકુવા, અમદાવાદ-૩૮૦૦૦૨

આથી તમો પ્રતિવાદીને અહીં જાણ કરવામાં આવે છે કે તમારી વિરૂદ્ધ આ કોર્ટ દ્વારા nરી કરાયેલા સમન્સ સતત અસ્વીકૃત રહ્યા છે અને તમારા હાલના સરનામા જાણમાં

હોવાથી આ સમન્સ પ્રકાશિત કરવામાં આવે છે. આથી ઉપરોક્ત નામના વાદીએ સીવીલ પ્રોસીજર ૧૯૦૮ ના કોડના ઓર્ડર નં XXXVII હેઠળ તમારી વિરૂદ્ધ કેસ દાખલ કરવાની તારીખથી ચૂકવણી સુધીના વ્યાજ અને પડતર સહિત **રૂા. ૬,૧૬,૧७૬-૦૧** માટે કેસ દાખલ કર્યો છે. તમને આથી પ્રકાશનથી દસ દિવસની અંદર તમારા માટે કારણ દર્શાવવા અને હાજર રહેવા માટે બોલાવવામાં આવે છે જેમાં નિષ્ફળ જવા પર વાદી એવા દસ દિવસ પૂરા થયા પછી કોઈપણ સમચે રા. ૬,૧૬,૧७૬-૦૧ થી વધુ નહીંની કોઈપણ રકમ અને કોર્ટે આપે તે મુજબ પડતરો અન વ્યાજની જે કોર્ટ કોઈ આપે તે રકમનો ચુકાદો મેળવવાને હકદાર રહેશે.

જો તમે તમારા માટે કારણ દર્શાવવા અને હાજરી આપો , તો વાદી તે પછી તમને સુનાવણી વખતે ચુકાદા માટે સમન્સ આપશે. તમે તે પછી કોર્ટને દાવાની મુક્તિ માટે બચાવ કરવા માટે

જો તમે કોર્ટને એફ્ડિવિટ **દ્વારા અથવા અન્ય રીતે સંતુષ્ટ કરો** છો કે યોગ્યતાના આધારે દાવા માટે બચાવ છે અથવા જો વાજબી હોચ તો બચાવ કરવાની રજા મેળવી શકાશે .

આજે તા. ૧૩મી ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ મારી સહી અને કોર્ટના સિક્કા હેઠળ તપવામાં આવ્યું.

तैथार કरनार તપાસી જોનાર (સી. એમ. મહીડા)

આસીસ્ટન્ટ

(કે. આર. પરીખ) બેંચ ક્લાર્ક

55 दि स्थिति हुनेन्द्र सिंह डाम ना थाथ तो मो मांञ्यु ईनाम <mark>परी</mark>

ઘરે બેઠા કામ બધાથી પહેલા મારૂ રીઝલ્ટ

જય સિકોતર માં જ્યોતિષ

નોકરી વિષચક

APPOINTMENT

શૈક્ષણિક

EDUCATION

ટીચર /પ્રોફેશર

Medium School Teacher

required in Bapunagar.

જોઈએ છે IELTS ફેકલ્ટી અને

અંગ્રેજી ટ્રેનર લેડીઝ/ જેન્ટ્સ 9724440089

સર્વિસીસ

SERVICES

ગૃહકાર્ય

જોઈએ છે અમદાવાદમાં,

<mark>દાદાની સાર સંભાળ કરી મેળવો</mark>

ડબલ પગાર. 9904806494

₹215

STAFF

એકાઉન્ટ- ફાયનાન્સ

જોઈએ છે આશ્રમ રોડ ઓફિસ

અને બાકરોલ ફેક્ટરી માટે

મેનેજર

એકાઉન્ટન્ટ 9825028147

9904809987

સમયે ઘરડા બા-

English

Experienced

Call: 9898143745

મસાણની રાખથી અને સાધકનું કરેલું કામ એકવાર જોવો

<mark>અહાભચાવ • છેડાહુરા • સ્રોવર્</mark>ચ TOA6 લત **પ્રોભ્લુમ • મ**થગમવે મુલ્લુ • કાર્યે તક ઊપ

98209528875

079-29623371 • 9824620955

For

Road,

9227229500

ર્શિટાયર્ડ

9263128147



(એ. પી. જોષી), રજીસ્ટ્રાર, સીટી સીવીલ કોર્ટ. ભદ્ર, અમદાવાદ

નામદાર જજ શ્રી પી. અગ્રવાલ સાહેબની કોર્ટ નં. ૨૩માં

જાહેર સમન્સ અમદાવાદની સીટી સીવીલ કોર્ટ ખાતે કોર્ટની કોમર્શિયલ કોર્ટમાં

કોમર્શિયલ સીવીલ સ્થુટ નં. ૧૦૮૦/૨૦૨૧

વાદીના વકીલ શ્રી - વાય. સી. શેઠ : ભારતીય સ્ટેટ બેંક , તેમની કેન્દ્રીય કચેરી મુંબઈ ખાતે , સ્થાનિક વડી કચેરી લાલ

દરવાજા, અમદાવાદ ખાતે, ઝોનલ ક્ચેરી - સી.એન.વિદ્યાલય પાસે, આંબાવાડી અમદાવાદ ખાતે, અન્ય ઠેકાણે તેમની શાખા/કરોરીમાંથી એક - સ્મોલ એન્ડ મિડિચમ એન્ટરપાઈઝ સિટી ક્રેડિટ સેન્ટર (એસએમઇસીસી) તરીકે ઓળખાત શાખા, સરનામુ: ૨૦૧, ૨૦૫, શુકન-11, સ્વસ્તિક ચાર રસ્તા, કોમર્સ કોલેજ રોડ નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯

વિરુદ્ધ **ાતિવાદી ઃ** ૧. મે . કેરાલૂન્સ વેન્ચર એલએલપી , બી/૩/૧૦ , સ્વાગત એપાર્ટમેન્ટ , કરૂણા સોસાયટ

પાસે , ભાવસાર હોસ્ટેલ સામે , નવા વાડજ , અમદાવાદ-૩૮૦૦૧૩. શ્રુતિ ભાનુપ્રસાદસિંહ કુશવાહ, બી/3/૧૦, સ્વાગત એપાર્ટમેન્ટ, કરણા સોસાયટ

પાસે , ભાવસાર હોસ્ટેલ સામે , નવા વાડજ , અમદાવાદ-૩૮૦૦૧૩ 3. નૈસર્ગ ત્રિભોવનભાઇ ગોહીલ, ફ્લેટ નં. એચ-૧૨૩, ઓર્ચિડ વ્હાઇટ ફિલ્ડ વોડાફોન હાઉસની પાછળ , પ્રહલાદનગર , મકરબા ગામ , અમદાવાદ .

स्थुट रङ्भ : ३१. ५,४५,४५३-४५ આથી તમો પ્રતિવાદીને અહીં જાણ કરવામાં આવે છે કે તમારી વિરૂદ્ધ આ કોર્ટ દ્વારા જારી કરાચેલા સમન્સ સતત અરવીકૃત રહ્યા છે અને તમારા હાલના સરનામાં જાણમાં ન હોવાથી અ

ાન્સ પ્રકાશિત કરવામાં આવે છે . આથી ઉપરોક્ત નામના વાદીએ સીવીલ પ્રોસીજર ૧૯૦૮ ના કોડના ઓર્ડર નં. XXXVII હેઠળ તમારી વિરૂદ્ધ કેસ દાખલ કરવાની તારીખથી ચૂકવણી સુધીના વ્યાજ અને પડતર સહિત રા. ૬,૪૬,૪૫૩-૪૫ માટે કેસ દાખલ કર્યો છે. તમને આથી પ્રકાશનથી દસ દિવસની અંદર મારા માટે કારણ દર્શાવવા અને હાજર રહેવા માટે બોલાવવામાં આવે છે જેમાં નિષ્ફળ જવા પર વાદી એવા દસ દિવસ પૂરા થયા પછી કોઈપણ સમયે **રૂા. ૬,૪૬,૪૫૩-૪૫** થી વધુ નહીંની કોઈપણ રકમ અને કોર્ટ આપે તે મુજબ પડતરો અને વ્યાજની જે કોર્ટ કોઈ આપે તે રકમનો ચુકાદો મેળવવાને હકદાર રહેશે

જો તમે તમારા માટે કારણ દર્શાવવા અને હાજરી આપો, તો વાદી તે પછી તમને સુનાવર્શ વખતે ચુકાદા માટે સમન્સ આપશે. તમે તે પછી કોર્ટને દાવાની મુક્તિ માટે બચાવ કરવા માટે કહી

જો તમે કોર્ટને એફ્ડિવેટ દ્વારા અથવા અન્ય રીતે સંતુષ્ટ કરો છો કે યોગ્યતાના આધારે દાવ ાટે બચાવ છે અથવા જો વાજબી હોય તો બચાવ કરવાની રજા મેળવી શકાશે


આજે તા. ૧૩મી ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ મારી સહી અને કોર્ટના સિક્કા હેઠા પવામાં આવ્યું.

तैथार કरनार (સી. એમ. મહીડા)



8511857303.

(એ. પી. જોષી), રજીસ્ટ્રાર, સીટી સીવીલ કોર્ટ, ભદ્ર, અમદાવાદ



Regd. Office: 'Trishul', 3rd floor, Opp. Samartheshwar Temple, Near Law Garden, Ellisbridge, Ahmedabad - 380 006. Corporate Office: 'Axis House' C-2, Wadia International Centre, Pandurang Budhkar Marg, Worli, Mumbai - 400 025. CIN: L65110GJ1993PLC020769, Phone: 079-26409322, Fax: 079-26409321, Email: shareholders@axisbank.com

UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30[™] SEPTEMBER, 2022

(₹ in lacs)

,	Axis	Bank (Standa	lone)	Axis Bank (Consolidated)			
PARTICULARS	FOR THE QUARTER ENDED 30.09.2022	FOR THE HALF YEAR ENDED 30.09.2022	FOR THE QUARTER ENDED 30.09.2021	FOR THE QUARTER ENDED 30.09.2022	FOR THE HALF YEAR ENDED 30.09.2022	FOR THE QUARTER ENDED 30.09.2021	
Total income from operations	24,180,08	45,907,69	20,134,39	25,258,80	47,945,26	20,966,61	
Net Profit / (Loss) for the period (before tax, exceptional and/or extraordinary items)	7,166,43	12,694,07	4,193,08	7,572,74	13,455,56	4,541,52	
Net Profit / (Loss) for the period before tax (after exceptional and/or extraordinary items)	7,166,43	12,694,07	4,193,08	7,572,74	13,455,56	4,541,52	
Net Profit / (Loss) for the period after tax (after exceptional and/or extraordinary items)	5,329,77	9,455,03	3,133,32	5,612,33	9,992,92	3,387,70	
Total Comprehensive Income for the period [Comprising Profit' (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	Refer note 1	Refer note 1	Refer note 1	Refer note 1	Refer note 1	Refer note 1	
Paid-up equity share capital (Face value ₹2/- per share)	614,46	614,46	613,33	614,46	614,46	613,33	
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	1,14,411,51 (As on 31st March, 2022)	1,14,411,51 (As on 31st March, 2022)	1,00,990,26 (As on 31st March, 2021)	1,17,495,94 (As on 31st March, 2022)	1,17,495,94 (As on 31st March, 2022)	1,02,980,95 (As on 31st March, 2021)	
Earnings per Share (Face value ₹2/- per share) (for continuing and discontinued operations) (₹) (not annualised)							
- Basic - Diluted	17.35 17.23	30.79 30.72	10.22 10.19	18.27 18.14	32.54 32.47	11.05 11.02	
Securities Premium Account	51,635,32	51,635,32	51,367,88				
Net Worth	1,16,152,45	1,16,152,45	98,916,07				
Outstanding Debts	1,81,399,99	1,81,399,99	1,58,709,45				
Outstanding Redeemable Preference Shares	Nil	Nil	Nil				
Debt Equity Ratio	1.46	1.46	1.48				
Capital Redemption Reserve	Nil	Nil	Nil				
Debenture Redemption Reserve	Nil	Nil	Nil				

Note:

Information relating to Total Comprehensive Income and Other Comprehensive Income is not furnished as Ind AS is not yet made applicable to banks

2. The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the website of the Bank (www.axisbank.com) and on the Stock Exchange websites (www.nseindia.com and www.bseindia.com).

3. Previous period figures have been regrouped and reclassified, where necessary, to make them comparable with current period figures

For and on behalf of the Board

Place: Mumbai Date: 20th October, 2022

લવ પ્રોબ્લેમ • છૂટાછેડા • શત્રુ પર જીત A to Z કોઈપણ કામ ધંધો-નોકરી • મનગમતું મિલન • લગ્ન-સગાઈ નું તાલ્કાલિક રિઝલ્ટ

ફસાચેલા નાણાં • પ્રેમ સંબંધ • કોર્ટ-કચેરી <mark>ઓછા ખર્ચમાં ક્રાય</mark>

ફોન પર ફ્રી સલાહ <mark>અમદાવાદ</mark> આજ સુધી બધા લાકેનો માટે લિગેર કામ <mark>શકે હોય કામ</mark> દાર્ટામાં સફળના

9587399777

ખ્વાજા ગરીબ નવાઝની દઆથી તાલ્કાલિક પરકેક્ટ પરિણામ

www.axisbank.com

AMITABH CHAUDHRY

CLASSIFIEI

BhaskarAd.com હવે ટ્યુકડી જાહેર ખબર ઓનલાઇન બુક કરો

રહો શેફ રહો) તાત્કાલિક પસેનલ કેશલોન Shree Raj ज्यातिष સાધના સત્ય છે, જાણકાર હોય તો કામ થાય પ્રોપર્ટી દિવસમાં TELECOM 4G કંપનીમાં એક મેળવો

> ધનલક્ષ્મી કાયનાન્સ 30,000 આધાર 9,90,000 2% બ્યાજ 50% ચૂટ સિવીલ ખરબ લોન પાયે:- 09354546589,

ધંધાકિય **BUSINESS**

ખરીદશું 9909522522

નામ પરીવર્તન

મારુ નામ અગ્રવાલ ચોગેન્દ્ર

જગદીશભાઈ હતું બદલીને

ભોજનગરવાલા યોગેન્દ્રકુમાર

જગદીશભાઈ રાખેલ છે. 3,

ગોપાલ નિવાસ, સંજીવબાગ

સોસાયટી,

અમદાવાદ- 380006

એલીસબ્રીજ,

06370950973

લાઈન ગ્રોસરી સ્ટોર બિગ આખા અમદાવાદ આપના બેંકમાં / પેઢીમાં ગીરવે <mark>સોનાના દાગીના વેચાણથી</mark>

છોકરા- છોકરીયો,

મહિના,

મકત.)

નામ,પતા

/WHATSAPP

9905391367,

ગ્રહણીય, ઘરેબેઠા કમાઓ

21500--45000

માટે

(મોબાઈલ+લૅપટૉપ

QUALIFICATION

GMP

Require HPLC Analyst Experienced For Q.C Dept. Contact: Intracin Pharmaceutical Ltd. C-1, B-53, G.I.D.C. Nadiad. Emailinfo@ intracin.com, enquiry@ intracinpharma.com

રેસેપ્સનિસ્ટ

ડાયાબિટીસ હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ (ફિમેલ/ જોબટાઇમ 2થી10 મેલ) 9328200746.

મલ્ટીનેશનલ

જોઈએ છે કંપન્તીમાં પાર્ટ્ ટાઈમ/્ ફૂલ ટાઈમ ્માણસો,ફિક્સ સેલરી + ઇનસેન્ટિવ એજ્યુકેશન 12 પાસ, હાઉસ વાઈફ/ રિટાયર્ડ પર્સન પણ આવકાર્ય. સંપર્કઃ-8733038513

ઓફિસ સ્ટાફ

only Young, smart, fluent

in English Receptionist,

Back office, tele calling

T e l e c o m - 4 G နံပူ-ျ် SMS ့ જોબ

<mark>21500- 45,000 મહીને</mark>

લેપટોપ, મોબાઈલ, મફત

-નામ સરનામુ sms /

WhatsApp 9905718432,

अन्ध

્છોકરા, છોકરીઓ,

ુ ઘરેબેઠાં કમાઓ

Sindhu bhavan

9924936038,

student

જોઈએ છે Swiggyને કુડ ડીલીવરી એકઝીકયુટીવ, ફુલ/ વીકએન્ડ શિફ્ટ તથા મનપસંદ એરિયા, ઈન્સેન્ટીવ, જોઈનીંગ બોનસ + ઈન્શ્યોરન્સ મળશે. સંપર્કઃ

ડાયરેક્ટ ભર્તી સુપરવાઇઝર 10વી 30000-70500 **૯७२४८८०११**८

Need Manager 9157674510.

9835706035 ગુપ્તદાનની પથ્થર જેવી સમસ્થાનો જડમૂળથી પરફેક્ટ નિકાલ તૂર્ટેલા સંબંધ • શત્રુજીત • બેક્અપ પછી ફરી મિલન પ્રાહ્યુમના આઇબનાવ • છૂટાછેડા • સંતાનસુખ • સોતનપીડા પ્રાહ્યુમના જોઈએ છે અમદાવાદમાં ઓન મનગમતું મિલન સંતાનચોગ કહ્યા વગર દારૂ છોડાવો સ્પેશ્ચાલીશ્ટ નારણપુરા, અમદાવાદ - દારે બેઠા કામ <mark>ગુપ્તદ્યનનાં મહાનફાતા</mark>

SMS

નોકરી

SMS

કરો-

બાસ્કેટના DSAને બીબી નાઉ રિટેલ સ્ટોરમાં બોપલ અને વેજલપુર સ્ટોર માટે ડિલિવરી કરવા માટે રાઇડર છોકરીઓ માટે પણ છોકરા- છોકરીઓ **Urgent Required in Visa** 8511650104 office Fresher Female

> WHO Pharmaceutical Company

> જોઈએ છે એલિસબ્રિજ સ્થિત

સર્વિસીસ **SERVICES**

ફાયनान्स

ખર્ચો લોનમાંથી કપાશે શ્રી કાઈનાન્સ

• પર્સનલ લોન 🔹 ગ્રુપ લોન • બિઝનેસ લોન • પ્રોપર્ટી લોન

દરેક લોન માત્ર ૨૪ કલાકમાં વ્યાજ-૨% છૂટ-૫૦% દગાખોરોથી સાવધાન 9667289913

ચાંગોદર / બાવળા CHANGODAR / BAVLA

વેચવાનું છે

વેચવાનો છે. પ્લોટ, 1000 ઈન્ડસ્ટ્રીયલ લાયક, 9558007221, સનાથલઃ 9173361331.

મણિનગર **MANINAGAR**

વેચવાનું છે

લાયક જૂનો બંગલો 200વારમાં જયહિન્દX 9016805570.

NARODA-NIKOL

વેચવાનં છે

વેચવાની છે કાચાકલ્પ. 500- 2000 Feet, Office, ગેલેકક્ષી. નરોડા, Tulja 9978402838, Estateગુપ્તાલનો લવ પ્રોલ્લેમ • મનગમતો પ્રેમ • બેક્સપ જુના-તૂટેલા બેક્સલ શત્રુજન • ઉદ્યરાણી • પ્રેમમાં દગો • સીતનપીડા સંબંધ જોડો પ્રેમ સંબંધ વિકિ <mark>મનપસંદ લગ્ન - સગાઇ</mark> સુખી લગ્ન જુવન ગુપ્તધનનાં કોઈપણ કાર્ય માટે રબરૂ મળો લાપાર-રેગ્ટ્ટીમાં બરૂર હાર્યાર-રેગ્ટ્ટીમાં બરૂર अन्थ **OTHER**

વેચવાનું છે

નવો બંગલો વેચવાનો છે હાથીજણ- મેમદાવાદ રોડ, 300 વાર પ્લોટ, 300 વાર બાંધકામ, Tulja Estate-9978417511, 9328005309

પેઇંગ ગેસ્ટ

પેઇંગ ગેસ્ટ / સ્ટુડન્ટ માટે

હોસ્ટેલ ફેસીલીટીસ, વિદ્યાનગર માં ઉપલબ્ધ છે વધુ માહિતી માટે. ८७६८०४४६८०

ફલેટ વેચવાનો છે, नवो સર્વન્ટ કવાટર સાથે, ઇસ્કોન આંબલી રોડ, 4 બેડ, Tulja 9978417780, Estate-9328005309

સાબરમતી-મોટેરા

SABARMATI-MOTERA

વેચવાનું છે

સાઈબાબા હાઈટસ, RTO સર્કલ

પાસે, સુભાષબ્રીજ, 2 બેડ, Tulja

Estate- 9978402271,

એસ.જી. હાઇવે

S. G. HIGHWAY

વેચવાનું છે

9328005309

ફલેટ વેચવાનો છે,

જ્યોતિષ **ASTROLOGY**

જ્યોતિષ

કુલ જોગણી જ્યોતિષ કાળીચોદસની લાભદાચી પૂજા માટે સંપર્ક આજે જ બુકીંગ કરાવો ગુપ્તદ્યન સપનામાં દેખાય છે <mark>અરજન્ટ</mark> છતાં મળતું કેમ નથી ? <mark>છુટાછેડા</mark> શત્રુ-વિજય <mark>સગાઈ-લ</mark>ુ તાનચોગ તૂટેલા સબંધ ગૃહકલેં બગડેલા કામનો ચોક્કસ સમાધાન 9724905457

લિસ્ટિંગ-LISTING

આવશે. મોઃ 8200804681.

અમદાવાદ : મુનલાઈટ, સોફા વોશીંગ કંપની, દરેક પ્રકારના સોફા પડદા, કારપટ તથા આફ્રાસ ચર વાશ કરા આપવામ

ક્લિનીંગ સર્વિસ

અમદાવાદ : સોફા ક્લીનિંગ અમદાવાદ એચ. પી. ફેસીલીટી સોફા ખુરશી, કાર્પેટ, પડદા, કાર, બંગલા, ઓફિસ, ડીપ ક્લીનિંગ 7802074942

પેસ્ટ કંદ્રોલ

અમદાવાદ : સાંઈ પેસ્ટ કંટ્રોલ સર્વિસ, (GOVT. APPROVED) ISO CERTIFIED COMPANY, ગાંધરહિત કેમિકલ દ્વારા ઉધઈ નિયંત્રણ, તથા જનરલ કંટ્રોલ ટ્રીટમેન્ટ, પેસ્ટ 9099986293

A રિપેરીંગ (એ.સી. ,વોશીંગ મશીન, પ્રિન્ટર)

અમદાવાદ : AC SERVICE તથા CAR WASH માટે એક જ સ્થાન, સૌથી સસ્તું સૌથી ઝડપી 'KAPPALI ECC FRINDLY SERVICE' CO. 8866679667

> લિસ્ટિંગની જાહેરાત આપવા સંપર્ક - 8200136994

ગુપ્તદાન સ્પે. માં અંદે છુટાછે**ટા સગાઇ-લ**ગ્ન લવ પ્રોલ્લેમ પ્રેમમાં દગો જૂના-તૂટેલાં સંબંધ ફરી જોડો એક જ ફોનમાં સમાધાન સાસરીયામાં હેરાન બહેનો ખાસ મળો -સંબંધોમાં નિરાશ લોકો ખાસ મળ બહેનો માટે ખાસ કામ કરવામાં આવશે 9825708798

<u>સાંઈધામ જચોતિષ</u> ખ્યાજા ગરાબ નવાબની રહેમતથા સીફ્લી ઇલમના મહાનુ જાણકાર ર વિત્સાઇ જોઈ વેદેશ યાત્રા,નોકરો- ઇંધો,સંતાનચોગ, મંબંધમાં તનાવ, ઘરકંકાથ, શત્રુ પર વિજય, મંત્રીને લાગતા પ્રશ્નોનાં નિરાકરણ, વેઝા પ્રોલ્લેમના તાત્કાલિક કામ પ્રો<mark>ઉલેમ ના ખાસ જાણકાર</mark> પર વિજયના કામ માટે ખાસ A TO Z સમસ્યોઓનો તાત્કાલિક નિકાલ LLL INDIA OPEN CHALLENG જેવું ઈચ્છશા તેવું થશે,My Promise બાપુનગર, ચાર રસ્તા, અમદાવાદ (M) 9537242311

જ્યોતિષ કેટેગરીની જાહેરાત આપવા માટે

વાચકોને આ અખબારમાં પ્રસિદ્ધ કોઇપણ જાહેરાતના સંબંધમાં પૈસા મોકલવા, કોઇપણ ખર્ચ ઉઠાવવા અથવા કોઇપણ વાચદા દાવા પર અમલ કરતા પહેલા જરૂરી પૂછપરછ કરવા અને યોગ્ય તપાસ કરવાની સલાહ આપવામાં આવે છે. ડીબી કોર્પ લિમિટેડ જાહેરાતકર્તાઓના ઉત્પાદનો અને સેવાઓ માટે કરાચેલ દાવાની

સંપર્ક કરોઃ 8200136994

જવાબદારી લેતું નથી ડીબી કોર્પ લિમિટેડના પ્રિન્ટર, પ્રકાશક, સંપાદક અને માલિક. - જો જાહેરાત આપનાર આવા દાવાનું સન્માન નથી કરતા તો દિવ્ય ભારકર પ્રકાશન સમૂહને કોઇપણ પરિણામ માટે જવાબદાર ગણી

શકાશે નહીં.

પાર્ટ ટાઈમ કામ્ કરીને રોજના food court and karigars immediately. Please call 10,000 કમાવો જેન્ટ્સ mo:-9667298812 9714636009

રજી. કંપની 07941057685 • आधारडाई सोन

PROPERTY

वेथवानो छे रहेवा/ Office

નરોડા-નિકોલ

9328005309

ઓનલાઈન બુકિંગ પર મેળવો આકર્ષક

1 **2 3** ત્રણ સ્ટેપમાં આપની <mark>ઘંઘાકીય</mark> એડ બુક કરો

BhaskarAd.com

Call: 97720 19222





